



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૮/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૦૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૯ કેસ કરી, ૪૪ વ્યક્તિઓને ઝડપી, ૨૨૯ લીટર દેશી દારૂ, ૯૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૯૦ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૪ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૯ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૫૩,૪૭૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૦૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૫ વ્યક્તિની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૦૮/૧૯

ચાંદખેડા: પ્રિયેશભાઈ બળદેવભાઈ પટેલ (રહે.વ્રજગોપી ગ્રીન-૪ પલોડીયા તા.કલોલ જી.ગાંધીનગર) એ તા.૦૨/૦૮/૧૯ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૮/૨૦૧૬ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન ચાંદખેડા વિસ્તાર સત્યમેવ હોસ્પિટલની પાછળ પ્રહલાદપાર્કની બાજુમાં ચાંદખેડા ટી.પી.સ્કીમ નંબર-૭૪ શ્રીનાથ કંટ્રકશન દ્વારા “શ્રી નારાયણ આર્કેડ” નામની નવી બનતી સ્કીમમા ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર-૩ કિમત રૂપિયા ૩૪,૦૦,૦૦૦/- તથા પ્રિયેશભાઈની પત્ની તૃપ્તીના નામે લીધેલ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર-૪ કિમત રૂપિયા ૩૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૮,૦૦,૦૦૦/- આરોપી (૧) મનુભાઈ જયરામભાઈ હીરપરા અને (૨) મનહરભાઈ જયરામભાઈ હીરપરા (બંને રહે.બાલાજીપાર્ક નેહરુપાર્ક લાડ સોસાયટી વસ્ત્રાપુર) એ ભેગા મળી નાણા મેળવી લઈ એલોટમેન્ટ લેટર નહી આપી તેમજ દુકાનના દસ્તાવેજ નહી કરી આપી પ્રિયેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર.દેસાઈ ચલાવે છે.

સરખેજ: દશરથભાઈ કરશનભાઈ રાવણ (રહે. શિવજી મંદિરની બાજુમાં કસલપુર ગામ તા-કાંકરેજ જિલ્લો-બનાસકાંઠા) એ તા.૦૨/૦૮/૧૯ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે માહે નવેમ્બર/૨૦૧૮ પહેલા થી તા.૨૯/૦૧/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) મીઠાપરા ભરતભાઈ મેરાભાઈ ઉર્ફે રાજુભાઈ રાઠોડ (રહે. સાંગણાપુર ગામ, તાલુકો-બોટાદ, જી-અમદાવાદ) અને (૨) ખાલીદ મહમદ સુલેમાની (રહે. સુલેમાની બાગ રેલ્વેપુલની બાજુમાં હરી શંકરનો આરો મુ-સિધ્ધપુર જી-પાટણ) એ ભેગા મળી આમ્રપાલી કોમ્પ્લેક્ષ ઓફીસ નં.૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭ હેવમોર રેસ્ટોરન્ટની પાછળ, બોપલબ્રીજ પાસે ઓફીસ ખોલી દશરથભાઈને તેમજ અન્ય વ્યક્તિઓને લોભામણી લાલચ આપી કંપનીમાં રોકાણ કરાવી વળતર આપવાનું કહી આરોપી મીઠાપરાએ રાજુ રાઠોડનું ખોટું નામ ધારણ કરી દશરથભાઈ પાસેથી રૂપિયા ૩,૪૫,૩૦૦/- તથા સાહેદ પ્રજાપતિ પ્રજેશકુમાર પાસેથી રૂપિયા ૪,૧૮,૫૦૦/- મળી કુલ રૂપિયા ૭,૬૩,૮૦૦/- તથા બીજા અન્ય વ્યક્તિઓના રૂપિયા લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.પી.સોનારા ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૦૯/૧૯

સાબરમતી: નિતિનભાઈ સુધિરભાઈ પટેલ (રહે.હેરિટેજ બંગ્લોઝ સાયન્સ સીટી સામે) એ તા.૦૨/૦૮/૧૯ રોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૧૮/૦૭/૧૯ સાજના ૭/૦૦ થી તા.૧૯/૦૭/૧૯ કલાક ૧૦/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન સાબરમતી ચેનપુર “સ્કાય વોક” ના ફ્લેટના ગોડાઉન દુકાન નંબર-૩,૪ ના તાળા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી આર.આર.કંપનીના ઇલેક્ટ્રીકના વાયર કિંમત રૂપિયા ૨,૨૨,૨૦૦/-, કદર મશીન નંગ-૨ તથા ડ્રીલ મશીન નંગ-૨ કિંમત રૂપિયા ૧૪,૨૦૦/- અને પ્લમ્બરનો સામાન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૫૬,૪૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એચ.વાળા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૧૦/૧૯

ગોમતીપુર: ભરતભાઈ ગણેશભાઈ જાદવ (રહે. કોટવાળી ચાલી ગાર્ડન પાછળ ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૦૨/૦૮/૧૯ બપોરના ૨/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેગળેસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અનોપસિંહ કિશોરસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.